



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૨/૦૭/૨૦૧૯ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૧૦૭/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૬૧ કેસ કરી, ૫૭ વ્યક્તિઓને ઝડપી, ૨૯૨ લીટર દેશી દારૂ, ૦૧ બોટલ ઈંગ્લીશ દારૂ અને ૦૧ કાર કબજે કરી હતી. તેમજ જુગારધારા હેઠળ ૦૬ કેસ કરી, ૩૬ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૪૮,૩૫૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૧૦૮/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૬૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૦૩ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૧૧૦૯/૧૯

દાણીલીમડા : રાહુલભાઈ ભરતભાઈ વછેટા (ઉ.વ.૩૨)(રહે.દેવજીત બંગલો નહેરૂપાર્ક સોસાયટી જુની હાઇકોર્ટ નવરંગપુરા) એ તા.૦૧/૦૭/૨૦૧૯ નારોજ દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૫/૦૪/૨૦૧૬ થી તા.૧૨/૦૯/૨૦૧૭ સુધી તથા તા.૧૦/૦૬/૨૦૧૯ બપોરના ૧/૦૦ સુધીના સમયગાળા દરમિયાન આરોપી વિનય ઓમપ્રકાશ ગુપ્તા (રહે.ગોકુલ એપાર્ટમેન્ટ એકુર રોડ નારણપુરા) એ રાહુલભાઈ સાથે કાપડના ધંધામાં ભાગીદારી કરી, તેમા લેવડ-દેવડના અલગ-અલગ બેંકો ના ચેકો નંગ-૬૫ કુલ રકમ ૧,૨૧,૭૮,૮૪૧/- ના ચેકો બદલાનતથી પોતાની પાસે રાખી લઈ, પરત નહી આપી રાહુલભાઈ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે.આ ગુનાની તપાસ પોસ.શ્રી જે.એસ.ગામીત ચલાવે છે

ધરફોડ :-

સમાચાર યાદી નં.૧૧૧૦/૧૯

કારંજ : રૂષભભાઈ સુરેશભાઈ જૈન (રહે. ગર્વેમેન્ટ "ઈ" કોલોની અંબર સિનેમા પાસે, બાપુનગર) એ કારંજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૯/૦૬/૨૦૧૯ રાતના ૮/૦૦ થી તા.૦૧/૦૭/૨૦૧૯ બપોરના ૨/૦૦ વાગ્યા દરમિયાન કારંજ ધી કાંટા જુની કલેક્ટર ઓફીસ સામે, કર્ણાવતી આર્કેડના બીજા માળે આવેલ પોતાની "S.R.J એપરલર્સ" નામની ઓફીસના શટર વીડોના સ્ક્રુ ખોલી, બારી વાટે અજાણી વ્યક્તિ ઓફીસમાં પ્રવેશ કરી, ડ્રોવરમાં મુકેલ રોકડ રૂપિયા ૨,૯૮,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૨ કિંમત રૂપિયા ૧૫,૦૦૦/- મળી કુલ રૂપિયા ૩,૧૩,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.શ્રી એસ.જે.ચાવડા ચલાવે છે.

મણીનગર : ધીરુભાઈ કાન્તીલાલ ઠક્કર (રહે.કમલકુંજ સોસાયટી, ભૈરવનાથ રોડ મણીનગર) એ મણીનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૮/૦૬/૨૦૧૯ સાંજના ૪/૦૦ થી તા.૩૦/૦૬/૨૦૧૯ સાંજના ૪/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના મકાનના દરવાજાનું તાળુ તોડી, અજાણી વ્યક્તિ મકાનમાં પ્રવેશ કરી, કબાટમાંથી (૧) હિરાનું મંગલસુત્ર નંગ-૧ (૨) સોનાનું મંગલસુત્ર નંગ-૨ (૩) હિરાની વીટી નંગ-૪ તથા રોકડ રૂપિયા ૨૭,૦૦૦/- તેમજ મકાનનાં પહેલા માળે આવેલ રૂમના કબાટમાંથી એક ગુરૂનો નંગ તથા રોકડ રૂપિયા ૪૦,૦૦૦/- ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જે.કે બાવીસ્કર ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૧૧૧૧/૧૯

ઇસનપુર : રીયાસત લીયાકત અંસારી (ઉ.વ.૩૫)(રહે.બાબાખાન રો-હાઉસ આશીષ હોટલ પાછળ મિલ્લતનગર ઢાળ શાહઆલમ ઇસનપુર) એ અગમ્ય કારણસર તા.૦૧/૦૭/૧૯ ના કલાક ૩/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પોતાની જાતે એસીડ પી લઈ આત્મહત્યા કરી છે. આ અંગે ઇસનપુર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી કે.એમ.ચાવડા ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.